

14th August, 2024

To,
Department of Corporate Services
BSE Limited
25th Floor, P. J. Towers,
Dalal Street,
Mumbai – 400 001

Security ID: RHETAN

Security Code: 543590

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on 30th June, 2024.

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on June 30, 2024 as per Regulation 47(1)(b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You.

Yours faithfully,

For Rhetan TMT Limited



Shalin A. Shah
Managing Director
DIN: 00297447

14-08-2024 Wednesday
FREE PRESS GUJARAT

Police nabs two accused roaming around in Khambhalia

Khambhalia, Pursuant to the instructions of Police Chief Nitesh Kumar Pandey to trace the absconders and convicted absconders in Devbhoomi Dwarka district, under the guidance of DySP Prajapati, the police teams led by PI Sarvaya launched an effective operation to trace the absconders. In which Khambhalia AD, Chief Judicial Magistrate Court of Criminal Negotiator, Act Section 138 of the criminal case, the court sentenced the accused to simple imprisonment of three months and ordered to pay a check amount of Rs.77,000 in full and Rs.7,000 as costs. Accused is not appearing in the court for the last five months, the accused is on the run and nego inst. The accused was sentenced to simple imprisonment of three months and ordered to pay a check amount of Rs.50,000 in full and Rs.7,000 as costs. Based on the information received by PO Cons Mandan Garhvi and Niral Luna of Wadi Beat of Khambhalia police station, further action has been taken to find the accused Bhakt Hira Makwana and Desur Dhanarant Suva and present them in court.

Cressanda Railway Solutions Partners with Shaurrya Teleservices

Ahmedabad, Cressanda Railway Solutions (BSE: CRESSAN) Formerly Known as Cressanda Solutions Ltd a leading private Railway auxiliary concierge service and digital media company has announced a strategic partnership with Shaurrya Teleservices Pvt Ltd for providing Wi-Fi and Content on Demand (COD) across the Eastern Railway trains. This groundbreaking initiative will commence with a pilot project on a long-distance train originating from the Howrah division and traveling to Barmer, Rajasthan. This partnership is poised to revolutionize digital connectivity in trains across India, marking a significant step towards realizing the vision of a truly Digital India. By offering enhanced connectivity, passengers will experience a more seamless and enjoyable journey, further bridging the digital divide. Shaurrya Teleservices Pvt Ltd: Shaurrya Teleservices is a leader in Neutral Digital consumer needs, infrastructure building and leasing rooftop sites, in-building coverage solutions, and small cell sites shared by major mobile operators such as Airtel, BSNL, Jio, and Vodafone Idea. The company is also dedicated to developing neutral passive infrastructure for Fiber to the Home (FTTH). With this new partnership, Shaurrya Teleservices continues to drive innovation in the telecom sector. (18-2)

Starlineps Enterprises Ltd. Board Approves 1:5 Stock Split & Bonus Issue

Ahmedabad, Starlineps Enterprises Ltd (BSE: 540492), a leading player engaged in the precious stone business, has announced that its Board in its meeting held on August 8, 2024, has approved the increase in company's authorized share capital, from 222 crores to 237 crores. This increase is subject to shareholder approval, which will be sought through a postal ballot. In a bid to increase share liquidity and make them more accessible to small investors, the company has also approved a stock split. Each existing equity share with a face value of 75 will be subdivided into five equity shares of 15 each. The record date for this stock split will be announced in due course. Moreover, the board has sanctioned the issuance of bonus shares in a 1:5 ratio, meaning shareholders will receive one additional share for every five shares held. This initiative is pending shareholder approval via postal ballot, emphasizing the company's commitment to rewarding its investors. (1-7)

"Udan Chhoo" Trailer Launch: A Love Story with an Unusual Twist



Ahmedabad, In a society where elopement stories are commonplace, Udan Chhoo dares to break the mould. This film revolves around a truly unconventional love story involving two middle-aged individuals who find themselves irresistibly drawn to each other amidst the chaos of their children's wedding. The tagline, "Yehvai-Vehvan Bhagi Gya Nehi!", perfectly encapsulates the unexpected turn of events that forms the heart of the film. The star-studded cast includes the versatile Deven Bhojani, the talented Aarohi, the seasoned Feroz Bhagat, and the promising Smit Joshi, among others. Each actor brings their unique charm to their roles, creating a vibrant and engaging ensemble.

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLICATION PVT. LTD. and Printed at: Dharti Printers C-3, Kalyani Chamber, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali fly crossing, mithakhali, ahmedabad. Editor : Mayur C. Bhatt

Kinetic Green Raises US\$25 Million from Greater Pacific Capital

Ahmedabad, Kinetic Green, a leading Indian manufacturer of electric vehicles (EVs), announced that it has secured a US\$25 million investment from Greater Pacific Capital ("GPC"), a leading global private equity firm, as part of an overall targeted Series A fundraising of up to US\$40 million. Kinetic Green entered the EV sector in 2016, as a pioneering EV OEM. The company is led by Sulajja Firodia Motwani, a third-generation member of the Firodia family, the founders of the Kinetic Group. Kinetic has been a leading manufacturer and distributor of India's automotive sector over the past 50 years, and is well known for iconic products including the Kinetic Luna and Kinetic Honda, selling over 10 million vehicles to date. The group is highly regarded for its commitment to developing advanced automotive technologies at affordable prices to drive mobility for the masses, with a focus on designing, developing and manufacturing products in India. (13-9)

Toyota Kirloskar Motor Promotes Holistic Approach



Ahmedabad, As champions of sustainable mobility, Toyota is committed to Carbon Neutrality by 2050 and aims to achieve Net Zero Carbon in Manufacturing Operations by 2035 guided by Toyota Environmental Challenges 2050 (TEC 2050). Today, marking the World Biofuel Day, Toyota Kirloskar Motor (TKM) reiterates its commitment to sustainable mobility. The company has been advancing greener mobility solutions with greater agility by introducing and supporting multiple clean technologies considering various factors such as the current energy mix, unique consumer needs, infrastructure readiness, and the Government's diversified efforts towards becoming 'Atma Nirbhar' in energy by 2047. India is the fastest growing large economy. The country's fossil fuel consumption along with imports is also rising rapidly, wherein the crude oil imports during April 2024 rose to its third highest level in record. India, world's third largest energy consumer imported 21.4 million tonnes (mt) of crude oil in April 24 & total 232.5 million tonnes of imported crude oil in 2023-24 fiscal (Source: April 2024 PPAC Data). Due to a large increase in mobility needs, the transport sector, which currently accounts for about 50% of oil demand (Source: IEA 2021), will be the most significant contributor to this. The higher fossil fuel consumption is also bound to result in larger carbon emissions. (20-4)

Creativeland Studios Entertainment ropes in Amish Tripathi

Ahmedabad, C. Sajan Raj Kurup, Founder & MD Creativeland Studios Entertainment and celebrated author Amish Tripathi announced their collaboration on 'Creativeland Studios Entertainment's film 'Shri Radha Ramanam' (SRR) a global theatrical feature on Lord Krishna 'Shri Radha Ramanam' (SRR) is a magical tale of Lord Krishna's love written by award winning writers Prakash Kapadia and Raam Moti with research and development having been undertaken for over two years, ensuring details are corroborated across scriptures and books. Under the leadership of prolific producer and Creativeland Studios Entertainment, CEO, Shobha Sant, this project has also roped in a Mythology specialist and Filmmaker Hardik Gajjar and ace cinematographer Ayananka Bose among others. VFX artists from three studios based in Vancouver, Los Angeles and Mumbai have been brought together to recreate and bring to life glorious mythical images of ancient Vrindavan, Barsana and Dwarka. With pre-production and VFX asset creation already underway, the film will start shoot in November this year. And, will be in the theatres worldwide in Feb 2026. Founder & MD of Creativeland Studios Entertainment, C. Sajan Raj Kurup said "Telling stories from India on a global scale is our mission at Creativeland Studios Entertainment and what better than Lord Krishna's story of love to tell the world, especially for the times we live in now. (19-10)

Bharti makes a strategic investment in UK - BT Group plc


Ahmedabad, Bharti Global, the international investment arm of Bharti Enterprises (Bharti), a leading Indian business group with world-class companies in telecoms, digital infrastructure and space communications, has reached an agreement to acquire an interest in c.24.5% of the issued share capital of BT Group plc from Altice UK S.à.r.l (Altice UK). The shares will be purchased through Bharti Televentures UK Ltd - a company established and wholly owned by Bharti Global. Bharti Televentures UK Ltd has entered into a binding agreement with Altice UK to acquire c.9.99% stake of BT Group's issued capital immediately with the balance c.14.51% of BT's share capital to be acquired following receipt of applicable regulatory clearances. Bharti and BT have an enduring relationship going back more than two decades. In 1997, BT acquired a 21% stake in Bharti Airtel and today marks a significant milestone in Bharti's history as it acquires a stake in the iconic British Company - BT, thereby strengthening the India-UK bilateral partnership. This investment in BT aims to support the commitment of our Hon'ble Prime Minister towards his vision in elevating and broadening the India-UK ties. Bharti hopes that this investment will further help create new synergies in the telecom sector between both countries in the areas of AI and 5G R&D and core engineering amongst others, offering great potential to collaborate on industry best practices and emerging technologies. (13-1)

Kid's favourite Nick Toons Motu-Patlu spread laughter and cheer



Ahmedabad, Get ready, Motu Patlu fans! Our favourite duo is back and better than ever with their latest adventure, Motu Patlu and Mission Kung Fu Kid! Filled with non-stop laughs, jaw-dropping action, and the same lovable friendship that makes them so iconic, Motu and Patlu are about to take all the kids out there on a kung fu journey like never before. To celebrate this big release, set to release on Nick on 15th August 2024, the duo visited Ahmedabad for a day packed with laughter, stories, and endless fun! The iconic pair began their visit by engaging with kids at Nest Public School where storyteller Dipole Solanki curated an engaging storytelling session based on the film. The plot saw interactivity and interesting cliffhangers which was a hit among the young students, who were thrilled to hear about the latest adventures of their favourite characters. Dipole Solanki is the founder of Rools, an organization dedicated to revolutionizing the education system through storytelling and other creative methods to create a more joyful learning experience for the children. This was followed by an exclusive screening of the film at the prestigious Bhanwar Rathore Design Studio School, where the students, who are the biggest fans of Motu Patlu, got a chance to watch the film alongside Motu Patlu and Helmed by filming director

Scattered rain in state with thundershowers



Ahmedabad, August 10 The forecast for the entire Gujarat for the next one week has been announced by the Meteorological Department. According to which, today there will be light rain with thunder at scattered places all over Gujarat. While Banaskantha, Sabarkantha, Patan, Aravalli, Anand, Dahod, Mahisagar and Chotaudepur districts, yellow alert has been declared with forecast of heavy rain at isolated places. It will rain in Ahmedabad and Gandhinagar today along with this, the Meteorological Department has instructed the fishermen not to venture into the sea for the next three days. Wind speed will be 35 to 45 km per hour. Monsoon trough is located over Bikaner. Ahmedabad and Gandhinagar are also likely to experience moderate to moderate rain with thunder today. Light to moderate rains with thundershowers are forecast at several places over North, Central and South Gujarat mostly in the next week. While in Kutch and Saurashtra, normal to moderate rain is predicted at isolated places in the next week.

In addition, since June 01, Gujarat has received 514 mm of rain, which is 11 percent more than the normal 462 mm. So Saurashtra received 458 mm of rain, which is 29% more than the normal 355 mm. Light to moderate rains with thundershowers have been predicted over the entire state till August 16.

WESTERN RAILWAY - VADODARA DIVISION
ENGINEERING WORK
E-TENDER NOTICE NO.DRM-BRC 076 TO 077 OF 2024-25 Sealed Tenders for and on behalf of the President of India are invited by Divisional Railway Manager (WA/C), Western Railway, Patanagar, Vadodra-390 004 for the following works. 1.Tender No : DRM-BRC 076 of 2024-25. Name of Work : Repairs to roofing of Dered Depot. Approximate cost of the work (In Rs.): ₹4,03,084.30 Bid Security to be deposited (In Rs.): 1,28,100.00 2.Tender No : DRM-BRC 077 of 2024-25. Name of Work : Need base repair of Existing hand pump for One star and Providing of New hand pump at required locations under jurisdiction of ADEEN GDA and ADEEN NRC. Approximate cost of the work (In Rs.): ₹5,82,891.70 Bid Security to be deposited (In Rs.): 19,300.00 For All Above Tenders Date and time for submission of tender and opening of tender : Tender is to be sealed on 14.08.2024 till 15.00 hrs and is to be opened on same date at 15.30 hrs. Web site particulars and notice for location where complete details can be seen : Address of the office from where the tender form can be purchased : Web site : www.irps.gov.in Western Railway, Patanagar, Vadodra-4
163
Log on to f facebook.com/WesternRail

Zee Theatre brings Ila Arun and KK Raina's acclaimed play



Ahmedabad, India's leading archival platform Zee Theatre presents 'Peechha Karti Parchhalyaan', a star-studded playheadlined by the renowned theatre, film, and music artist Ila Arun, Theatre Veteran KK Raina, Popular Television actors Param Singh, Priyamvada Kant, and Vijay Kashyap. The intergenerational drama is the culmination of the enduring creative synergy between Ila Arun and KK Raina and was first performed in 2016. Adapted by Ila Arun from Norwegian playwright Henrik Ibsen's classic play 'Ghosts', it is directed for the stage by stalwart director KK Raina and helmed by filming director Saurabh Shrivastava for television. It has staged more than 50+ shows across India with great success in sold-out shows. It will now be available on the small screen with the click of a button. Trailer link: https://www.youtube.com/watch?v=_C0sML8c5vc Published in 1881, 'Ghosts' critiqued outmoded social mores, and 'Peechha Karti Parchhalyaan' reflects similar themes. KK Raina plays the role of a stern Purohit while Ila essays the matriarch, Yashodhara Baisaheb. Actor Param Singh portrays Yuvraj, the conflicted scion of the Rajput family. The play brings forth the emotional and psychological toll of maintaining facades, showing that the price of duty can be devastatingly high. As the narrative unfolds, the audience will witness the heartbreaking consequences of Ranu Yashodhara's sacrifices and the tragic inevitability of her son's fate. Commenting on the teleplay, Ila Arun says, "The play talks about a story of a woman who has been haunted all her life by the shadow of traditions, rituals, and entrenched thought patterns. (19-10)

RHETAN TMT LIMITED

CIN: L27100GJ1984PLC007041
Registered Office : 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad 380 006, Gujarat, India

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024 (Rs. In Lakhs)

PARTICULARS	Quarter ending	Year ended on	Quarter ended on
	30-06-2024	31-03-2024	30-06-2023
	Unaudited	Audited	Unaudited
Total income from operations	1934.90	6521.36	2429.96
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	100.84	525.07	94.82
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	80.67	387.04	75.86
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	80.67	387.04	75.86
Equity Share Capital	7968.75	7968.75	7968.75
Reserves (excluding revaluation reserves as shown in the Balance sheet of Previous year)	-	-	-
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)	0.01	0.05	0.01
Diluted:	0.01	0.05	0.01
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each) (not annualised)	0.01	0.05	0.01
Diluted:	0.01	0.05	0.01

Notes:
The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.rhetan.com)
The above Financial results are reviewed and recommended by the Audit committee and approved by the Board of Directors at its meeting held on August 12, 2024.

For, Rhetan TMT LIMITED
Sd/-
SHALINI A SHAH
MANAGING DIRECTOR
DIN: 00297447

Date : 12/08/2024
Place : Ahmedabad

CRESTCHEM LIMITED

CIN: L24100GJ1991PLC015530
Regn Office Address: Sr. No.550/1, Sub Plot No. 12, Village- Indrad, Taluka- Kadl, Mahesana- 382715
Corporate Office : 303B Central Business Space, Opp Fortune Landmark Hotel, opp. HFDC Bank Near Usmanpura Crossroad, Ashram Road, Ahmedabad- 380013
WEBSITE: www.crestchemlimited.in Phone: +91-9409119484

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2024 (Rs in Lacs)

Sl. No.	Particulars	STANDARDISED FINANCIALS		Year ended	Year ended		
		Quarter ended				31.03.2024	31.03.2023
		30.06.2024	31.03.2024				
		Un-audited	Audited	Audited	Audited		
1	Income						
	Revenue from operations	524.62	563.31	377.59	2,125.62		
	Other Operating income	-	-	-	1,672.83		
a)	Total Income from Operations (net)	524.62	563.31	377.59	2,125.62		
	Other Income	8.33	9.24	4.70	26.16		
	Total Income (net)	532.95	572.55	382.29	2,151.78		
2	Expenses						
a)	Cost of Material Consumed	380.47	410.16	311.49	1,610.24		
b)	Purchase of Stock-in-Trade	-	-	(0.28)	-		
c)	Changes in Inventories of Finished Goods, Work-in-progress and stock-in-trade	-	-	-	0.25		
d)	Employee benefits expense	24.65	25.49	10.89	66.86		
e)	Finance Costs	0.33	0.63	0.07	0.62		
f)	Depreciation & amortization expenses	1.08	1.43	0.48	4.63		
g)	Other Expenses	43.70	42.33	27.80	171.41		
	Total Expenses (net-worth-defeat)	450.23	479.84	350.46	1,853.77		
3	Profit before Tax (1-2)	82.73	92.71	31.83	298.01		
4	Tax Expenses						
(i)	Current Tax	23.11	26.56	8.30	83.87		
(ii)	Deferred Tax	(0.17)	(0.51)	(0.03)	(0.18)		
	(Short / Excess Provision of Income Tax)	0.41	-	-	0.41		
	Total Tax (1+ii)	22.94	26.46	8.27	83.38		
5	Profit for the period (3-4)	59.79	66.25	23.56	214.63		
6	Other Comprehensive Income						
7	Total comprehensive income for the period (5+6)	59.79	66.25	23.56	214.63		
8	Profit-upon-liquidation and other comprehensive income for the period)	300.00	300.00	300.00	300.00		
9	Earning per equity share (EPS) in (not Annualised)						
	BASIC	1.99	2.21	0.79	7.15		
	DILUTED	1.99	2.21	0.79	7.15		

Notes:
(I) The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under section 133 of Companies Act, 2013 read with Rule 3, of the Companies (Indian Accounting Standards) Rule 2015 and Relevant Amendments thereunder.
(II) The above Unaudited Financial Results for the Quarter ended June 30, 2024 have been reviewed by the Audit Committee by the Board of Directors in their respective meetings, 28th August, 2024 and a Detailed Review of the same has been carried out by the Statutory Auditors of the Company.
(III) The Statutory Auditors of the Company have carried out a 'Limited Review' of the above results as per Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
(IV) The Company operates only in one segment viz. Nutritional- Chemical Industries.
(V) Figures for the prior periods have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.
(VI) Figures for the quarter ended 31st March, 2024 are the balancing figures between audited figures for the full financial year and the reviewed year-to-date figures upto the three quarters of the respective financial years.

By order of Board of DirectorsFor
Crestchem Limited
Dipak Patel
MANAGING DIRECTOR
(DIN - 02052080)
Place : Ahmedabad
Date : 12th August, 2024

